

# ધિક્કારપાત્ર હિંસા અને નાગરિક અધિકાર

## તથ્ય શીટ

# DFEH



રાલ્ફ નાગરિક અધિકાર અધિનિયમ ગર્ભાવસ્થા, બાળજન્મ, અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓ, જાતિની ઓળખ અને લિંગ અભિવ્યક્તિ, જાતિ, રંગ, ધર્મ, વંશ, રાષ્ટ્રીય મૂળ, વિકલાંગતા, તબીબી સ્થિતિ, આનુવંશિક માહિતી, વૈવાહિક સ્થિતિ, જાતીય અભિગમ, નાગરિકત્વ, પ્રાથમિક ભાષા, ઇમિગ્રેશન સ્થિતિ, રાજકીય જોડાણ અથવા મજૂર વિવાદમાં સ્થિતિ સહિતના કોઈ પણ વ્યક્તિના વાસ્તવિક અથવા માન્યતાવાળા લિંગ/ જાતિને કારણે હિંસા અથવા હિંસાની ધમકી સંબંધિત કાર્યોને પ્રતિબંધિત કરે છે (કેલિફોર્નિયા નાગરિક સંહિતા કલમ 51.7). આ સૂચિબદ્ધ લાક્ષણિકતાઓ ફક્ત દાખલા છે અને અધિનિયમ હેઠળ ભેદભાવ દાવા માટેના અન્ય પાયા પણ શક્ય હોય શકે છે. નાગરિક કાયદા દ્વારા પ્રતિબંધિત કૃત્યો ગુનાહિત કૃત્યો પણ હોઈ શકે છે અને ઉલ્લંઘન કરનારાઓને ગુનાહિત દંડ થઈ શકે છે. રાલ્ફ નાગરિક અધિકાર અધિનિયમ, ફરિયાદ અથવા મુકદ્દમો નોંધાવવા અથવા એટર્ની જનરલ, વાજબી રોજગાર અને આવાસ વિભાગ (Department of Fair Employment and Housing, DFEH), અથવા ફરિયાદી અથવા કાયદા અમલીકરણ એજન્સીને જાણ કરવાના અધિકાર સહિત વ્યક્તિને માલ અથવા સેવાઓ માટેના કરારમાં પ્રવેશવાની શરત તરીકે અધિનિયમના સંરક્ષણની માફી મેળવવા માટે પણ પ્રતિબંધિત કરે છે.

## DFEH શું કરે છે

વાજબી રોજગાર અને આવાસ વિભાગ, કેલિફોર્નિયાના નાગરિક કાયદાને લાગુ કરે છે કે જે નિમ્ન દ્વારા ધિક્કારપાત્ર હિંસા પર પ્રતિબંધ મુકે છે:

1. ફરિયાદોની તપાસ;
2. કાયદાના ઉલ્લંઘનોની કાયદેસર કાર્યવાહી; અને
3. કેલિફોર્નિયાના લોકોને ધિક્કારપાત્ર હિંસા, માનવીય તસ્કરી, સત્તામણી અને લેખિત સામગ્રી પ્રદાન કરીને અને સેમિનારો અને કોન્ફરન્સમાં ભાગ લઈને ભેદભાવ પ્રતિબંધિત કાયદાઓ વિશે શિક્ષિત કરીને.

## કેલિફોર્નિયા કાયદા હેઠળ કયા પ્રકારનાં કૃત્યો પ્રતિબંધિત છે?

કેલિફોર્નિયાના કાયદામાં મૌખિક અથવા લેખિત ધમકીઓ, શારીરિક હુમલો અથવા હુમલો કરવાનો પ્રયાસ, છેદન અને તોડફોડ અથવા મિલકતને નુકસાનની મનાઈ છે. કેલિફોર્નિયાના અન્ય કાયદા અમુક કૃત્યો માટે ફોજદારી દંડ કરે છે જેમાં પ્રાર્થના કરવા માટે ભેગા થયેલા લોકોના જૂથને ખલેલ પહોંચાડવું; કોઈ પ્રાર્થના સ્થળ અથવા ધાર્મિક શૈક્ષણિક સંસ્થાની માલિકીની અથવા તેમના દ્વારા અધિગ્રહીત બિલ્ડિંગમાં તોડફોડ કરવી; હિંસાની ધમકી આપીને ધાર્મિક પ્રવૃત્તિઓ ન થવા દેવાનો પ્રયાસ; અથવા, મિલકતને માલિક અથવા રહેનારની જાતિ, રંગ, ધર્મ, વંશ અથવા અન્ય સુરક્ષિત આધારોને કારણે લક્ષિત કરવામાં આવી હોય તો બોમ્બ અથવા અગ્નિનો ઉપયોગ કરીને વ્યક્તિને તેની પૂજા સ્થળોએ અથવા કોઈ પણ ખાનગી મિલકત પર તેની વ્યક્તિગત સલામતી માટે ડરાવવું શામેલ છે.

## આ કાયદાઓ કેવી રીતે પીડિતોને મદદ કરે છે?

આ કાયદા એવા લોકો માટે નાગરિક ઉપાય પૂરા પાડે છે જે જાતિ, રંગ, ધર્મ, વંશ, રાષ્ટ્રીય મૂળ, વય, વિકલાંગતા, લિંગ, જાતીય અભિગમ, રાજકીય જોડાણ અથવા મજૂર વિવાદમાં સ્થિતિને કારણે હિંસાના કાર્યો અથવા હિંસાની ધમકીઓનો ભોગ બને છે.

ઉપલબ્ધ નાગરિક ઉપાયોમાં શામેલ છે:

1. પ્રતિબંધિત હુકમ
2. વાસ્તવિક નુકસાન
3. શિક્ષાત્મક નુકસાન
4. નાગરિક દંડ
5. એટર્ની ફી

આ કાયદાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલ અધિકારોનો ઉપયોગ કરવા માટે ઘણા પગલાં લેવામાં આવી શકે છે.

